

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રમ્પટન ઓટો વીમાના દર માટે વાજબી દરોની

હિમાયત કરવાનું ચાલુ રાખે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (14 ફેબ્રુઆરી 2022) – સીટી ઓફ બ્રમ્પટન પ્રોવિંશલ સરકારને યાદ અપાવવાનું ચાલુ રાખે છે કે ઓન્ટારિયોના વીમાના દરોની સમીક્ષા અને સુધારા કરવામાં આવવા જોઈએ.

એપ્રિલ 2021માં બ્રમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો કે બ્રમ્પટનવાસીઓ ઓન્ટારિયોના સૌથી વધુ વીમાના દર ચુકવે છે અને તેમણે [#FairDealForBrampton](#) અભિયાનનું લોકાર્પણ કર્યું. આજના દિન સુધી 19,000 કરતા વધુ રહેવાસીઓ પેટિશન પર સહી કરીને અભિયાનમાં સહભાગી થયા હતાં.

ગત માસમાં, RATESDOTCA દ્વારા [ઓન્ટારિયોના શહેરો માટે કરના વીમાના પ્રિમિયમો](#) પર તેમના ઓટો ઇશ્યોરામેપના આધારે લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે પોસ્ટલ કોડના આધારે પ્રિમિયમોની યોજના દર્શાવે છે. આ લેખમાં સિટીના [#FairDealForBrampton](#) અભિયાનનો સંદર્ભ આપે છે જે વીમાના દરો નક્કી કરવાના પ્રાથમિક પરિબલો તરીકે પોસ્ટલ કોડનો વીમા કંપનીઓ ઉપયોગ કરે તેના પર પ્રતિબંધ ફરમાવે છે. બ્રમ્પટનમાં, દરો 26.8 ટકા જેટલા ઘટ્ટ્યા એટલેકે 2021માં \$2,698 થી \$1,975 થયા. બ્રમ્પટન ઓન્ટારિયોના સૌથી મોંઘા શેરથી ખસીને સૌથી ચોથું મોંઘું શહેર બન્યું.

બ્રમ્પટન સીટી કાઉન્સિલની માંગ છે કે ઓન્ટારિયો સરકાર બિલ 42 *એન્ડિંગ ડિસ્ક્રિમિનેશન ઇન ઓટોમોબાઇલ ઇશ્યોરન્સ એક્ટ (Ending Discrimination in Automobile Insurance Act)*, ને રજૂ કરે જેથી બ્રમ્પટનના નિવાસીઓ માટે જીવન વધુ સમાન બને અને કિફાયતી બને.

સિટીના [#FairDealForBrampton](#) અભિયાન વિશે વધુ માહિતી www.brampton.ca/fairdealforbrampton.ca પર મળી શકશે.

સુવાક્યો

"અમારા રહેવાસીઓ અને સમગ્ર ઓન્ટારિયોના લોકોએ COVID-19 મહામારીથી ઉદ્ભવતા નાણાકીય પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખ્યું હોવાથી, અમારા પ્રોવિન્સમાં ઓટો વીમાના ઊંચા ખર્ચને સંબોધવા માટે સરકારના તમામ સ્તરોએ સાથે મળીને કામ કરવું જોઈએ. અમે અમારું #FairDealForBrampton અભિયાન શરૂ કર્યું ત્યારથી 19,000 કરતા વધુ રહેવાસીઓ વીમા ઉદ્યોગમાં પરિવર્તન કરવાના અમારા કોલમાં અમારી સાથે જોડાયા છે. પ્રોવિન્સલ સરકાર બિલ 42 *દ ઓન્ડિંગ ડિસ્ક્રિમિનેશન ઈન ઓટોમોબાઇલ ઈન્શ્યોરન્સ એક્ટ (Ending Discrimination in Automobile Insurance Act)* રજૂ કરે તે માટે બ્રેમ્પટન સીટી કાઉન્સિલ અને રહેવાસીઓ એકજૂટ થઈને ઊભા છે, કે વીમાના દરો નિર્ધારિત કરવા માટે પોસ્ટલ કોડનો ભેદભાવ બંધ કરો.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ગયા વર્ષે બ્રેમ્પટનમાં ઓટો વીમા પ્રિમીયમમાં ઘટાડો થયો તે આવકારદાયક સમાચાર હોવા છતાં, આપણા રહેવાસીઓએ તેમના પોસ્ટલ કોડને કારણે પ્રોવિન્સમાં સૌથી વધુ દરો ચૂકવવાનું ચાલુ રાખવું પડ્યું છે. બ્રેમ્પટન સીટી કાઉન્સિલ ફરીથી પ્રોવિન્સલ સરકારને ઓન્ટારિયોમાં ઓટોમોબાઇલ વીમા દરોની સમીક્ષા કરવા અને સુધારા કરવા હાકલ કરી છે, જેથી અમને #FairDealForBrampton મળે અને આપના શહેરના વાહનચાલકો માટે જીવન વધુ કિંકાયતી બની શકે.

ગુરપ્રીત ધિલ્લોન, રિજનલ કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca